

# Visit of External Affairs Minister, Dr. S. Jaishankar, to New Zealand and Australia (October 05-11, 2022)

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની

મુલાકાત (05-11 ઓક્ટોબર, 2022)

03 ઓક્ટોબર, 2022

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 05-11 ઓક્ટોબર 2022 નાં રોજ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે.

2. આ તેઓની ન્યુઝીલેન્ડની પ્રથમ મુલાકાત હશે. ઓક્ટોબરમાં, વિદેશ મંત્રી ન્યુઝીલેન્ડમાં વસવાટ કરતા ભારતીય સમુદાયનાં સભ્યોને તેઓની અદ્વિતિય સિદ્ધિઓ અને યોગદાનો બદલ સન્માન કરવા માટે ન્યુઝીલેન્ડનાં વડાપ્રધાન મહામહિમ શ્રીમતિ જેસિન્ડા આર્ડેર્ન સાથે 06 ઓક્ટોબરનાં રોજ એક ઇવેન્ટમાં ભાગ લેશે. આઝાદીનો અમૃત મહોત્સવ ન્યુઝીલેન્ડને યાદગાર બનાવવા અને પ્રદર્શન કરવા માટે બન્ને નેતાઓ ભારત@75 ટપાલ ટીકીટનું અનાવરણ કરશે. વિદેશ મંત્રી 'મોદી@20: ડ્રીમ્સ મીટ ડીલિવરી' પુસ્તક લોન્ચ કરશે. શિખ સમુદાય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં ખાસ લગાવને પ્રદર્શિત કરતા એક પુસ્તક 'હાર્ટફેલ્ટ – ધ લીગસી ઓફ ફ્રેન્ડશિપ' નું પણ અનાવરણ કરવામાં આવશે.

3. આપણા દ્વિપક્ષીય સંબંધોનાં તમામ પાસાઓની ચર્ચા અને સમીક્ષા કરવા માટે વિદેશ મંત્રી ન્યુઝીલેન્ડનાં વિદેશ મંત્રી મહામહિમ શ્રીમતિ નાનાઈઆ માહુતા સાથે દ્વિપક્ષીય મીટિંગ કરશે. તેઓ ભારતીય મૂળનાં ન્યુઝીલેન્ડમાં પ્રથમ મંત્રી બનનાર ન્યુઝીલેન્ડનાં સમુદાય અને સ્વૈચ્છિક ક્ષેત્ર, વૈવિધ્યતા, સમાવેશકતા અને મૂળભૂત સમુદાયો અને યુવાઓ માટેનાં મંત્રી મહામહિમ શ્રીમતિ પ્રિયંકા રાધાક્રિષ્ણન સહિતનાં કેટલાક મંત્રીઓ, સાંસદો, વ્યાપાર સમુદાયનાં સભ્યો તેમજ ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાયનાં લોકો સાથે પણ સંવાદ કરશે. વેલિંગ્ટનમાં, તેઓ હાઈ કમિશન ઓફ ઇન્ડિયાનાં નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે.

4. ઓસ્ટ્રેલિયામાં, વિદેશ મંત્રી કેનબેરા અને સીડનીની મુલાકાત લેશે. આ વર્ષે આ વિદેશ મંત્રીની ઓસ્ટ્રેલિયાની દ્વિતિય મુલાકાત હશે, પ્રથમ મુલાકાત મેલબોર્નમાં ફેબ્રુઆરી 2022 માં ક્વોડ વિદેશ મંત્રીઓની મીટિંગ મેલબોર્નમાં હતી. વિદેશ મંત્રી તેઓનાં સમતુલ્ય મહામહિમ શ્રીમતિ પેની વોંગ સાથે 13માં વિદેશ મંત્રીઓનાં ફેમવર્ક સંવાદ (FMFD) યોજશે. વિદેશ મંત્રી ઓસ્ટ્રેલિયાનાં નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી મહામહિમ શ્રીમાન રિચાર્ડ માર્લેસને પણ મળશે. તેઓ સીડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યુટ સહિત ઓસ્ટ્રેલિયન નેવીસ મીડિયા અને થિંક ટેંક સાથે પણ સંવાદ કરશે.

નવી દિલ્હી

03 ઓક્ટોબર, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.